2010 Before -Satpanth Manuscript 18 -Manhar Ginan & Others (168)




realpatidar.com
realpatidar.com


realpatidar.com
realpatidar.com

[illegible]

realpatidar.com

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

१

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

वि हत पप नोकुट ब्रि ज रा अपि:
अपलो अपलो नाम अपपनो सअप रीछि:
अपप र अपीपछी टि अप रपनत सरीट
अपलो अपलोकि ता लपनो सोत रीटि
पिरि जि पी रीतिन पी अप वीना सा
अपनन अपपरनी तल टि अपासा
पत ननि अपरथि लल टि सारगप रापु:
टि ता हि कान हारी पुरप लाडु:
पतततल साटि पनी सोवाकरीटि
कि पल लगाती गिनारीहि भाद्धरीटि

साटि पर सप पि अपर पप हुधरि
नाछोडि अपपरनी अपासरे:
सरपि अपासापरहु रे:
ता गारनरति रि पासरे:

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

सारथे छरतीए ब्रिह कनीएः
तेन एकरी जन रथ ना होएः
परगाट होए ते जपा जन रथ पाए
हरी परगाट मा हरी न नगाएः
ने ने लख सा डा होए त्री साः
ते हरी न न परगाट न गाही साः
हरी न न लख सा डा क्रो हा म घहः
जन न न जन न रमा सा म गी रे हः
सात लख सा डा कछ ए ने हः
ए कमना मनीपर र सह पए ते हः

ए कमना पछ ते सा ला पा
सा पछा न पछ म ह गा त रे
ने मा ते मा क री जमा ह रीः
लख स पाके री मह गा त रेः

सगत गक्री=पाह री =पि पा त
पवि रे गतीमानपी गी स्वाक्ी स्वाक
सगरु हा गाक्ी व्याद्य पर हरीए:
हरी ननतागः=पसातनद्यरीए:
सारुप मनव्यीलिरी । रा त
=पननत=पयुगायालोमगापत
हरीनन हरी मरुपी गनन नगाहे
=अपरगारुगाजीलो छा रे:
हरप्प नी स्वीक नद्य रे साहाई
परम्रिपगारुक्र रे हीतमीतलाए:

परम्रिपगारी परमारपी:
हरीन नतीमनागरे
नेतीकागक्रे रीहा पी=आपीनही
नीरपालख्षी हीतगागरे:

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

३०

हरी हरी लनन पे मं[redacted] केसांनलीलें ह

ज्ञ्रीमर्या ते मा रवे ह:

नरनारलगतसांहा=देहे

=पलन=पतरमानसाहे ह:

नाराऍ पानरने पीसारेनहो

तीनरलनामनाराऍपा साहो:

ऍक=पतरमाने लनवारूप:

=पामपरऍकहोछेतहरूप:

पोरेमावासानवमाइसारहेव

ऍरपामनरतऍकनापमकरेसांव

ऍकमरतऱपा हेवछे

=पतेऍकहीऍकवपापारे

तीगापपतीपापी=पा

१२०॥ छेरे ठमनकरीपीछापारे

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
३४॥ [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
37॥ [illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
३८।। [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

॥४७॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

सत सगतनी जो वा घर होः
पारन पाजे कोई तेज हनत होः
ए कमन जो वाई फिरी घर होः
सत सगत रे साधन लानोः
सत सगत रे साधन ला नोः
फेरे मजे माने पाई फेरे मटी समान
फेरे सटी समाने साध जिहरी नोः
=पतन =पमरणव जन गाता हरी जो
सावधान पाकवे रे रे। रानन
साचे सामर ... रेलतनः

realpatidar.com

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

सावत१ईपरनावे रधे गासा
कारतकवे द१९ नेवारको हेगा
ऌेम्मा नेते आरकी हो छे: ऌेम्म
कमाई रतनाहे वनो =पापीसा
मे मीकारगागमीकाही =मा=मा
पगाघानारेवासी: नेवी पेरत
पतीतेवानोईनेऌे मली छेतेमा
कोटेकानोगत्र =मन्यसर =मोछे
=पदको हीछेतोवामनाराताना
नेवा मनोनरलो मकाणमनी
सामे मापकरनो साटेवपा
कपहेनमामा =पनाछ =मपून
नपूमछे गातनमातनानामो
टामाई माईवा मेते पासा
मपेतेने सारपने =मगारानमसम
२६६

realpatidar.com

https://archive.org/details/bk168/page/n67/mode/1up

(૧)

શ્રી સતગોરજી મોવાયા પરઘાલ
ણા આછે ગોર ઈમામસાનાં ॥ ૪ ॥
પરગટ પર છો ગોર ઈમાંમ મનો ॥
જુગ માં જાણોને અજતજ ॥ જાગતી
જોત જાંબુદીપ માં ॥ પરગટ દેખો
સામા પીરજ ॥ પરગટ પર છો ગોર
ઈમામનો ॥ ૧ ॥ ઘામ ઘણા ઘરતી
ઉપર સો ॥ તીરથ તીરથ નાં ઘાટ જ ॥ એ
વી સુંદર નગા સોભતી ॥ એ વોન ઈ
આવે કુઈ ડાકજ ॥ પરગટ પરે ॥ રોજા
જોઈ નીરાજ થઈ એ ॥ આનંદ ઉપજે
મન માં એજ ॥ આક પો હોરને મો
સટ ઘડી ॥ સું પેર ઈ એતાં અજ ॥ પર
ગટ ॥ ૩ ॥ પરથમ કુંહું પી રાણાત ણું ॥

વીગતે કરું વીસતાર જી ॥ અલપ બુધી
એથી ઓમ કરું ॥ ગોર મોરી લજા રાખણ
હાર જી ॥ પરગટ ॥૪॥ ગોર ભસતથી
આવી આ ॥ આ એવા દુનીઆની માં
અજી ॥ હાજર એગ ઈજુંર માં ॥ હુકમ માં
નેછે તાં અજી ॥ પરગટ ॥૫॥ હાજર એગ
સોપતે આવી આ ॥ આ વ આવંન બડી
માં અજી ॥ એકલું ટારો ઓરત ધવીરસ ॥ લું
ટવા આવો ગોર નેતાં અજી ॥ પરગટ ॥૬॥
સનમુખ આવી ઉભો ઓર ઓ ॥ તીર પડા
વીકમાંન જી ॥ ત્રીલોકીનાથ જાણા નહીં
॥ કામ કું એથી કમાન જી ॥ પરગટ ॥૭॥

(૨)

ઘણીનોપરછોતછુંકડો॥કામકેવાં
કરતેણીવારજા॥લુંટાટાતણોહાથઉં
ચોરઓ॥તીરનાં છું ટોલગારજા॥પ
રગટ॥૮॥પરગટપરછોનંદેખાડી
ઓ॥આવીપડોગોરનેપાઅજા॥અ
નાથવાંનધું ઓલખાનહીં॥માંકૂગું
નોકરીસાઅજા॥પરગટ॥૯॥અરજ
કરીકહું એરલું॥ ભવોભવઆપનો
દાસજા॥અવીમલભગતીઆપો
આપની॥રાખોમરણાનીપાસજા॥
પરગટ॥૧૦॥અનંતપરકારેઅરજક
રી॥કીરપાકરીદઆવંતજા॥સેવકજા
ણીસાથેલેવા॥ખબરલીધીખુંદા
વંતજા॥ પરગટ॥૧૧॥પરથમપરછો

પુરીનો ॥ આવારા આબર મતીતીરજી ॥
તાંરે આવીકામ ફેવાં કુરાં॥રસું ણોરસ
ઉભું મન વીરજી ॥૫૫॥ રાગ ૨ ॥૬૨॥ ઘ
પો ॥ હુંકુમ કરો ઓઈજુંરા॥ હોડીવાલાને
તાંહી ॥ જાવું પુંરન દીપારા ॥ વચનસું ણો
તું ભાઈ ॥ લોને ડોછાહા મ ॥ પરથમ ઉતા
રો અમને ॥ કામ કરોજ કુરરાજ કુદીરી
શુંતમને ॥ હાહેરો ॥ તારે હોડીવાલો એમ
બોલી ઓ ॥ વારા કુરતી ઉતારે સહી ॥ ઉ
તાવલ હો અજો એવડી ॥ તો મારગ
મોકલો છે અહી ॥ છ પો ॥ સતગોરેસું
ણીકાન ॥ વચન બોલા જે એવા ॥ હાજર

(3)

જોગનેકહ્યું॥કામકરોકહુંતેવાં॥અલી
નબીકાનાંમલેદી॥પુંરમાંજઈપડીએ
॥ગાડીનાંખો પુંરમાંહે॥સહીકોઈજીન
વનડીએ॥દોહેરો॥નામનબીનુંલેઈ
કરી॥અનેગાડી ઉતારીસહી॥કહેજનધું
દાસજેહું॥સહુંઅચરત પામાંતહીં॥
છપો॥પરગરપર છોનાંએ॥ગોરે દેખા
ડોતાંહીં॥હોડીવાલોમન માંહીં॥વીલા
પકરેછેતાંહીં॥મુંજ પાપતણોનહીંપાર
॥પરલુંનાંવમનનાંમાંનાં॥દોહેરો॥મું
જપાપતણોપારઆવેનહીં॥ઘેરગંગાઆ
વી સહીં॥કહેજનધુંજેઅલાગીઆ॥જગ
તારણજાણાનહીં॥છપો॥વીપરીતજો
ઈનેવાત॥ગઆગોરપાસેજાંઈ॥ગુંનો

મારુ કરાવવા॥ પ્રીત માં એવું મારી॥ સહું
ને પુંછતો જન આ॥ જલી રીતે પણ તમી
ઓ॥ વાર ઘાર સહું જો ઘા॥ જંગલ માં જઈ
મળી ઓ॥ દો હેરો॥ અફલ ફલો એ ગો
રત્ન ણી॥ તે ફો ઇનિ ફલે સહી॥ ફ ઈબ્ન ઘું
બેતે હું તો॥ દરસ સન દીધાં તહી॥ રાગ પ
રભાતી પરગટ પરછા એવા પુરી નો॥
આવાગર મથા તે ગા॥ મળ॥ મુંકા મકરો
સરોવર પીસો॥ દેવાં કરાં ત ઇકી મળ॥ પર
ગટ પર રુપ હું ફ મફરો હોજર બેગન॥ જવ
પરેલની પાસ જ॥ પરેલ ને જઈ તિમે એ
મ કહો॥ મુંજ ગોર આવા આણેવા સજ॥

(૪)

પરગટ॥૧૪॥હાજરએગતાંથીઆલી
આ॥ગઆપટેલનીપાસજી॥હુંકમકે
રોમારાગરૂજીએ॥તમેઆપોમુંજને
ગાંસજી॥પરગટ॥૧૫॥તારેપટેલએ
મબોલીઓ॥ગાંસનઈમલેકાંઈજી॥
॥સાતદુંકાલીકાલઅહીપડો॥મેહનાં
વરસેલગારજી॥પરગટ॥૧૬॥સાચો
હોએજોતારોસતગરૂં॥મેહવરસાવે
આણીવારજી॥આરઆપુંઘણીપેરની
॥અમતમતાણુંથાએકામજી॥પરગટ
॥૧૭॥સોબાલુંરથઈયાધાકુરા॥આવા
ગરૂંજનેપાસજી॥અબોલાઆવીનેબે
ઠાઆસને॥મનમાથઈનેઉદાસજી॥
પરગટ॥૧૮॥અનતરજામીએતંઈ

જાણી ઉઠીફાનરઓગને પુંછેયાતજા॥કુમે
રેકારણસોખાતુંરથઆ॥વીસતારીને
કહોવાતજા॥પરગટ૨૧॥ અરજકરી
ઉભારઆ॥ગોરમોરીલજારાખણહા
રજા॥મેહેપેરસાવોમંછાકરી॥તોથાઅ
આપણું કાજજા॥૨૦॥પરગટ॥ખુંસી
થઇમુંહાવંતબોલીઆ॥નીસેકરોને
નીરાંતજા॥પટેલનેજઇનેલહેરકરો
॥મેઘમંડારનેમઘરાતજા॥પરગટ॥
૨૨॥ આનંદથઇને ઉઠીઆ॥ગઆપ
ટેલનેપાસજા॥ગોરેકઉએવુંજઇકીધું
પતારેપટેલેઆપોગાંસજા॥પરગટ૨૩॥

(૫)

રાતપડીરમતમાં॥ગોરેકીધી છેકી
રપાઅજી॥હાજરએગની અરજસુણી
॥ગોરેકેવાંકીધાંકામજી॥પરગટ॥૩॥
ઉતરમાંહેથી ઉલટો॥થઈરીઓછે
અંધકારજીધણીનાં ધુંબાકાતાં થઈ
રબા॥મેહેવરસો મુંસલ ધારજી॥
પરગટ॥૪॥જલવીજલતાં થઈ
રહ્યા॥રચાર ઈ રંગની રેલજી॥તરા
હીતરાહીસઉંકોકરો॥ તરાહીકરેપ
ણપટેલજી॥ પરગટ॥૫॥સભા
મેઆવારતગોરતણો॥માંણસ
માંવસઉંતાંહજી॥પરથમપટેલ
પણઆવીઓ॥તઈમો ટું કઉતક
થાઅજી॥પરગટ॥૬॥સરોવર

શ્રી

પરસતગોરતણો ॥ તંભું દીઠી તરતાં
અજ ॥ અરજ કરેસ ઉં ઉભાર ઘી ॥ ફવે
કુમ કરીજવા અજ ॥ પરગોરપરછ ॥
અરજ કરીજાં ઈમાંમને ॥ ગોરે કરી છે
ફીરપા અજા ॥ રૂ માંલનાં ખીસઉંને
બોલાવીઆ ॥ લખી લખા સઉંલા
ગેપા અજ ॥ પરગોરપરછ ॥ લલેપર
ભુંજ પધારીઆ ॥ અમ સેવકુની લે
વારસા અજ ॥ લલેરેલું તલવાસે
આવીઆ ॥ ફીરપા કરીઆપો આપ
જ ॥ પરગોરપરછ ॥ પાએનમાપરેલ
બોલીઆ ॥ ગોર માંગું એકુ વચનજ
॥ આપકુર માંપોતે કીજ એ ॥ ફીરપાકુ

(૫)

રોઆપોઆપજી ॥ પરગટ ॥ ૩૦ ॥ પુરેસી
થઇ ગઇ જ બોલીઆ ॥ મારે જોઇએ એન
હીકાં ઇજી ॥ તીરકેંકું માંરો જાંપડે ॥ જગ ॥
બાંધાવું તાં અજી ॥ પરગટ ॥ ૩૧ ॥ એ વીરી
તે કરાર કરીને ॥ કબુલ કરું સરવે તાં અ
જી ॥ પટેલ પણ પાએલા ગઇ એ ॥ આ
નંદ ઉરિમાં નમાં અજી ॥ ૩૨ ॥ પરગટ ॥
શ્રી લોકીનાં થે તીરકેંકી એ ॥ જઇ નેપડે
છે જે ઠાર જી ॥ તેરે ૬ કાણે મોટો સીહવસે
॥ પાલીની કલો તે ણીવાર જી ॥ પરગટ ॥
૩૩ ॥ ગોરજીમાં પરગટ થઆ ॥ સુંનધર
બનાવું તઇ ધાંમજી ॥ જજ કાર સઉને
વાપીઓ ॥ તે પારાણા પરણ નામજી ॥
પરગટ ॥ ૩૪ ॥ એ કુવાર તેજ આવી સો ॥ મેનત

ફરતા મનુંર જી॥ ગાદીકેરે થીનીતનાંણું
આપતા॥ પારસેઓ લાવીકનું રજી॥ પરજ
ર॥ ૩૫॥ એક મનુંરે મનમાં વીચારી ઉ॥
ગાદીકેકે નાણું અપાર જી॥ રાત પડે આ
વીલે ધની ઉં॥ એ વોકરો છેવી આર જી॥
પરગ॥૨॥૩૬॥ રાત પડે તે આવીઓ॥ ઓ
દીત પાસું તમાં મજી॥ એક પધરાનો પણ
જડો નહીં॥ કુંતગ કરું ગોરઘમાં મજી॥
પરગ॥૨॥૩૭॥ સાંજ ભીજ નારે મડી॥ મ
નુંરને આપ છેદા મજી॥ તારે ચોર મનું
રને ઓલાવીઓ॥ એમ ણું આપે તે ને દા
મજી॥ પરગ॥૨॥૩૮॥ તે મનુંર તારે ઓલી

(૭)

ઓ॥ આવાઅમણું નાંહીઅ જ॥ તારે
બીજા મનુંરે વીઆરી ઉ॥ આકુરાણ
સુંદીઆઅ જ॥ પરગાર॥ ૨૯॥ તારે ગોર
ધમીંમરસા ઓલીઆ॥ અઆતેરીઓ
લ મનુંરી જ॥ રાતે સંકુટતનો અદું પડી
॥ મા ટેલોનો અમણાંદા મ જ॥ પરગાર
॥ ૩૦॥ એ વીરીત મનુંરની॥ અબર
લીધી ખું દાવંત જ॥ દાસ્તદલ માંતેના
નવગણો॥ આપે થઆ દઆવંત જ
પરગાર॥ ૩૧॥ એ કુસમે મહમદ બેગડો
॥ અમ દાવાદનો બાદસાઅ જ॥ પાર
ખું લેવા પંડે આવી ઓ॥ મન માં કુરીને
કરાવ જ॥ પરગાર॥ ૩૨॥ મહમદ બેગડો
એમ બોલી ઓ॥ લલાત મોનેબોનેનજ॥

એમકુદીને આગલ ધરીપ કુપર કરી આ
પોતાં અજા॥ પરગ॥ ૪ ૩॥ શ્રી લોકીનાં
થેતાં જાણી ઉ॥ આદસ આવો પાર
ખું લેવા અજા॥ સ ઉતાંજન સહું સાંભ
લો॥ ઘણી માંરી કુંવાંકરે કામજા॥ પરગ
ર॥ ૪ ૪॥ તારે ગોર ઇમાં મરાવોલી
આ॥ સલાસ ઉંસું ણો તેતમાં મજા॥ કા
અહુંઅમારે બોલી મરપડી॥ ઉઠજાતે
રે મકામજા॥ પરગર॥ ૪ ૫॥ ગોર મુંખ
થીજાં બોલી આ॥ આલરસ મરડીને ઉ
ઠીથા અજા॥ ઉઠી આપે ગોરને પાઅ
પડી॥ તાંથી સાલવતે જા અજા॥ પરગર
॥ ૪ ૬॥ પરગર પરછો દેખાડી આ ॥

(૬)

સઉને થઓ છે આનંદજી ॥ આદરશાનું મ
નમાંનું નહીં ॥ એવો છે મતીમદજી ॥ પર
ગટ ॥ ૪૬ ॥ વ્રતજું કરીને કુઉત્તકકુરૂં ॥ માંસ
ભાવોતે એણીવારજી ॥ રકૈબી માંસની મું
ડી આગલ ॥ ભોજન જમો સુંદર સારજી ॥
પરગટ ॥ ૪૭ ॥ ઘણા નો પર છોત ઇ ખું
કુડો ॥ ઘણી માંરી કેવાં કરે કામજી ॥ રૂમાલ
છાંકેલો ઉઘાડીઓ ॥ લવીંગ સોપારીત
માં મજી ॥ પરગટ ૪૯ ॥ સભા સઉને
વેંચી આપીઉં ॥ લજી લજી સઉ લાગે
પાએજી ॥ જગત ઓધારણ લેઆ
વીઆ ॥ ધંન ધંન ગોર ઇમાંમજી ॥ પર
ગટ ॥ ૫૦ ॥ કરી પર છો એવો પુરીઓ ॥
આદરશાવું જોને નહીં મન માંએજી ॥ આ
જું કુઉંત્તકકુરીત ઇંઢીકૂં ॥ સભા સઉંવેંડી

છેતાં અજ પપર ગ રપપર અરેદંઘમાં

નાં આ ઉંપાળા લાકી ગોરનેપારસ

જઅમા ડાંમેઘાં જુંગતે જ મોપદલમાં

હું ડા છેવીઆરજ પપરગ રપપર ગા

રણીમાં જેર પા ગ આપરંકુ લપકુરી

ગ આ આપ જતરલા રેઉ અમરલ

થઘીમોરાકો ઘઆવા પીરજપર

ગરપપરુ સભારજ હું ખુંરાથઆ

લજ્ઞાલજ્ઞાર ઉંલાગે પા અજપદઆ

વંતદીલમાં દઆકુ રપકુ ટીકુ પાપ કુ

રામાંકુજ પપરગ રપપરા અવતાર

થ... અવનીવી રોપધારાભગલ

(૯)

તારણહારેજી ॥ ધંનતાત મંતરે અમ
ન ગીઆ॥ આપે દીધા છે દીદાર જી॥ ૫૨
ગ॥ ૨॥ ૫૫॥ આદરસા પગે પડો ગોર
તણો॥ અરજ કરી છે અરદાસજી॥ અ
નાંથ બન ઘું માંગું એટલું॥ માહરું નો
કરો કેં દાસજી॥ ૫૨ ૩॥ ૨॥ ૫૬॥ જગતાર
ણ જાણ ઘાન કીં॥ નાંજાણ ત્રી ભોવન રા
અજી॥ દાસ ઉપર દયા લાવી નો॥ કી
રપા કરી આપો આપજી॥ ૫૨ ૩॥ ૨॥ ૫૭
॥ અરથ ગરથ માંગો ઉતરથી॥ આ
પું ગામ ને ગરાસજી॥ આપ ફૂર માંવો
તે હાજર કરું॥ રાખો સરણાની॥ દાસજી
॥ ૫૨ ૩॥ ૨॥ ૫૮॥ ગોર ભ [illegible] માં એમ બોલી
આ॥ મારે જો ઇએ નાં કાંઅજી॥ રાજ પું

સીથીતમેરાજકરો ॥ તમે જાવતમા
રેમુંકામજ ॥ પરગટ ॥ ૫૮ ॥ પેરેમ
કરીપરણાવી ઓ ॥ આવાએ ટીઅમ
તણીજ ॥ અરજ માંગીતાંથી આલીઓ
॥ ગઓ પોતાને મુકામજ ॥ પરગટ ॥
૬૦ ॥ પરગટ પરછાએવા પુંરીઆ ॥
ધણી માંરો કેવા કરે કામજ ॥ અકલક
લાકો ઈનિવકલે ॥ ધંન ધંન ગોરઈમા
મજ ॥ પરગટ ॥ ૬૧ ॥ મોટું કામ એકગો
રેકરૂં ॥ એ છે અનાંથું નો નાંથજ ॥ જે કોઈ
આવે તેનાં અરણાવીસો ॥ ધણી માંરો હે
તેઝાલે હાતજ ॥ પરગટ ॥ ૬૨ ॥ રેવા
સીલોછગરસેરનાં ॥ લવાણાઆમણ

नोरनाथजी॥ तेनां गोरे कामकेवां करां॥
सुणो मोमन तेनी वातजी॥ पर२०।२
६३॥ सरवे मली संघ काडी आ॥ आ
वाका सोती रथवा टका॥ आलतां
आलतां त ही आवी आ॥ आवा
पीराणा नेठामजी॥ पर२०।२॥६४॥
पडाव करी पाद रवीसो॥ संघ पली
आतमां मजी॥ दरसन करवा रन उं
तन आली आप॥ सुंदर जो वाने धाम
जी॥ पर२०।२॥६५॥ संघवी सतेनां
आवीआ॥ सुंदर जे आमुं कामजी॥
सलाम करी तां गोरन॥ पुंछे गोर ईमा

ભળ ॥ પરગટ પદ ૬ ॥ પુરખ થઈ મુંધા
વંત બોલીઆ ॥ કોન મુંલકુ રસે સત
રે નાંજ ॥ કોન મુંલકુ જાં નાં નું મ સહો ॥
કે આકાર ણઈ લું માં રેજ ॥ પરગટ પદ ૭ ॥
સં ઘવાલા સહુ બોલીઆ ॥ ઉતર દી
ધો તે ફીયાર જ ॥ કા સતીરથ બાવા
જે કુ ઈમી ॥ આ માં રેતવું છે તાં એજ ॥
પરગટ પદ ૮ ॥ દી દાર કુરવાને આ
વીઆ ॥ જોવાન ગાત ણો ઠાઠ જ ॥ કા
લેઅ મોઅ હીથી માલી સું ॥ ન ઈસુંડા
સતીરથ ઘાટજ ॥ પરગટ પદ ૯ ॥
તારે ગોર ઈમાં મ સા બોલીઆ ॥ ફેરે
મે

जोध सउनां मनजी॥ कीरपा घरडा
स उपर करी॥ मेहेर करी तणीवार जी॥प
२०। ८॥ ७०॥ तीरथ वारनी सनमरनम
सुंणो॥ जमेला णा कारनी घाटजी॥ दीदा
र पावो तो कारनी तणा॥ घणा हो आजीनुं
मारी जी॥ पर२०। २७१॥ सत गोरनी पा
से पडा॥ सरन सुंणो गोर धमीं मनजी॥ द
रसन देखाडो कारनी तणा॥ दआ करी दीदी
दार जी॥ पर२०॥ २०७२॥ सरन करी तां ध
धमीं मन॥ दआवंत हुं सकरो दुरजी॥
आप हुरमां वोतेहमे कीजी आ॥ प्रेरे मेल
गतीनो धनीर पुंरजी॥ पर२०। ८॥ ७३॥

तारे गोरे ब्रमा अेम बोली आ॥ अमी
जपत मारे मुंकाम जा॥ धीछात मारी हो
अगति सोंपावेगी॥ कालेका रसी कादेवो
धाम जा॥ परगट॥ ७२॥ वमन रसुं पणी
सउं गोरेन पणो॥ आवा पोताने मुकाम
जा॥ अेरे वालतो अेरे नेरही॥ धपण मांरो
कुवां करे काम जा॥ परगट॥ ७३॥ कुमनी
वारे हमा करी॥ अेहेम नांभु नोना
थजा॥ हीरपाकरी दास उपरे॥ धपण मांरो
हेते आलेहोत जा॥ परगट॥ ७४॥ गोरेब्र
मांअनंतर धानथ धी॥ आपे पांआवधी
कुटधाम जा॥ मरी जनां कुं धनी पणे नही॥

નજાણે પોતાનો હોએ અધારસજી ॥ પરગાર

૭૭ ॥ આપેતાં અનતર ધાનથ આ॥ નમ

તેજગા માંતેણીવારજી ॥ કાકા સહુ સો

ઘવા લોગી આ॥ કારણ અનું સુંડી રતાર

જી ॥ પરગાર ૭૮ ॥ સો આતુર સઉં સે

વડુથ આ॥ મન માંભ આપળ ઉ ઉધારસજી

॥ વીતાપડુરી ડાભો ડામ જુવો ॥ કું ધણીઆ

જાંણુ દીપનાંવા સજી ॥ પરગાર ૭૯ ॥

અરેન ડુરે સઉ ધમાંમ નો ॥ ગોર માંરીલ

નાસ પાણહાર જી ॥ છલ ડુરીને આમન છે

તરા ॥ એમના હીન ડુરી રતાર જી ॥ પરગાર ॥

॥ वध्रुइर पतीवी मारी मै॥ तेना रामों
आगीवारे ज॥ नहीं आवो अवसर वी
षोला सेतमां रीनेला ज॥ पद २ ॥ २७ ॥
दुषनी वारे हे आवु रे॥ अधारो पीरा एा
नी मांई जे॥ आरे अवसर नो आव्यो नहीं॥ ह
ईतज अे अमोसारे ज॥ पद २ ॥ २८ ॥ आ
वीरे इ अंतर मां धरी॥ के आरे तन वा
लाज॥ नां मर्ध मीं मनुं ले ध्रुरी॥ हईतजानो
डुरे उपाअज॥ पद २ ॥ २९ ॥ ३॥ पाडेमे डुरे
स उसवेड॥ आपेल एुं वध्रुइरवारी ज
॥ मीड पडेरे मांराभ गलुं नो॥ दु षे दुत्माग्र
मुं ज हासज॥ पद २ ॥ ३० ॥ ॥ आवेंजा एी

आपेआवी आ॥ परगरथ आपत राजा

मांगेजा॥ मसत्तपुरीरे गंगा लावी आ॥ राणी

पोतानीते पारसजा॥ परगार॥८पा॥ हीदा

रथ आसउंदासने॥ डीर पाडुरी आपो आप

जा॥ प्रेम सहीत गोरने पाए पडा॥ थधी

रए छेजेने हारजा॥ परगार॥ ९ ॥ धंन धं

नवखंडरनां थनो॥ धंन धंन गोरधी [illegible] आम

जा॥ जगलुं डारेण डाम डेवां डरमां॥ गंगा

लावा मसत्त लाभेज॥ परगार॥ १०॥ ए

वातता एरले रही॥ ती रथवा सीनुं थ उंडा

मजा॥ गडूने पर ताए सेउजनी रहुं॥ सरवे

सुताछेतां मजा॥ परगार॥ ११॥ दोहेरो पा

हवे घणा दुनीआवीओ ॥ गफलतानां आवे अने
कु॥ परगट दीधो पारखुं ॥ गा रखीमां मछे अे कु॥
६८ ॥ लुग मांजणो अेकदु ॥ अवर मांनणो
कुछ ॥ गावरन रन दी मान सो ॥ दीन गल रस सा
ख ॥ ६० ॥ छ पो ॥ भरनी हरालर पुर ॥ सउस्नु
ताछेन ईं ॥ अलो कीनां थेतर तकालन ॥ मा आ
रमावी तां ही ॥ अनुं कासी पुर धाम ॥ म कोम
तां अडा ॥ मर हका ॥ तेने कुरतां ते सावार ॥ दस
मांन रतनां कुंका ॥ दोहु रोप ८ ह ॥ भगतकां
म कुवां करां ॥ घंन घंन घणी कवाम छे ॥ कहेअ
न धुतार अवार सीतणां ॥ नंनमतां दुखडा टली
जाअ छे ॥ छ पो ॥ भरनी दराभीतां हे ॥ परमा
तम गारसहु ॥ कउतकने वुं कामन ॥ घी हुं कासी पुर

घामे ॥ नीरमलसरणुनी सा॥मा होगं
गांण गान॥ सोत्नान उतम सार॥ सईरसुल
तां घेरे॥ दोहरो॥ मरम कुलाकु घणि गोनही॥
सतगोरे कामकुरां सही॥ कुई बंधु बेसेनी डेला
॥नगमां कुघणि गोनही॥ छपो॥ हती हुं नडीले
घ पास॥ गमाडे कुगानो घी॥ पगीउ करवे
पार॥ हुंडीनां परतगदीधां॥ लेमा परमां
गोदाम॥ हालगणीने दीधां॥ दोहरो॥ हुंडी
वरावी सरवमेली॥ तीरथ आवा गंगात
गो॥ कुईमन धुंबे गोरत गो॥ परतापथी
॥ काम केवां तघमां मनो॥ छपो॥ परे मेप
डासउ मांहे॥ गंगानां असनानां करघो॥ नां
पनि पमानीरमल॥ आनंद थमां घवल

छे पछे आतो मे दान ॥ सदुगुरे भणे ने रडी
॥ मन ग मता भोजन ॥ अनुभ आंतेअ वरावी ॥
दोहेरो ॥ दान दअणा दी घी घणी ॥ जे जे कार
सउने थआे ॥ कुईअन धुरसउ रंघते ॥ मुकाम
पोताने गआे ॥ छपो सुकरीत करीने काम ॥ मुं
काम पोताने आव्या ॥ र लोत्री बीघीता ॥
मढांअमर कुल लाव्या ॥ तेना पुनत णोनही
पार ॥ आे रासी कुरे टाला ॥ दोहेरो अमर
कुंकोंदे देकरी ॥ रातेसुता सउ रस ही ॥ कुईअन
धुअे परभाते मां ॥ कउते कुकुसुं भालेन ही ॥
राग परभाती सुता कुंडे गोरें सुं कुंई ॥ मा आ
सं कुेलीते एीवार ॥ सदुगुरु सहुने कहे कांणेथ
आ ॥ काम कुवां करे की रता र ॥ पर ग ट ॥

2010 Before -Satpanth Manuscript 18 -Manhar Ginan & Others (168)

ए२॥ सुतां सवारे सउला उठला॥५ डु उतडमां
टूंडुवा अलज॥ आरे डाराणलां घरिसुंनीपलुं॥
गोरे डुरी छेडीरपा अलज॥ परगट थए ३॥
अेपुंलणी सउतां आवी आ॥ आवागोर
जनीपासज॥ प्रेम सहीत गोरने पाअप
डा॥ छ घमित मारा दा सज॥ परगट थए ४॥
लालेपरयवा मांपरगटथआ॥ समसेर
डुनी लेवा सारज॥ सेवडुलणी राणी आभर
णली अे॥ धंन धंन जां पुदी पनां रेणअज॥
परगट थए ५॥ घपो धंन धंन गोर धम
म॥ परथम दीदार न पाआ॥ धंन धंन तम
परतापा॥ डारनी डे दीदार दिधा आ॥ धंन धंन
तं म परतापआ सनां न गंगामां डीधां॥

धंन धंन तम परताप ॥ दान लराम ने दीधां ॥
दोहरो परगट परताप छे तम तणो ॥ दासनु
दे दुष्टी मारसही ॥ कहे अंनधुं को ए किलाकले ॥ मो
मी उपर लालोनहीं ॥ राग परबानो ॥ अनत
परकार मरन करी ॥ लखल खमापनां गुला
मज ॥ कीरपा करीने सेवक रप ॥ मरन सुणो गो
रख मीं मज ॥ परगटप ८ ५ ॥ परभो घदी
घो परेम भी ॥ जनो ए उतारी मे मांही ॥
ज ॥ नाम रूपी जनो एपेरी मे ॥ मेवुं आला
सहुतां मज ॥ परगटप ९ ॥ सरवे जनो
ए उंतारी उं ॥ उतारी भणत सेवा मज ॥
तांथी सहु मे गोरने थापी मा ॥ सेव उथ

आरहुतांहे जा॥ पद २१ ॥ राग गोरे सउ
सेव करतणा॥ ओलाउ करघरवानां मन
जगततारण छे रे जगतना॥ धणीमांहे वां
कुरे करमन॥ पद २२ ॥ राग पंजोगोरनो
आई रघे॥ नानां रतनानी मांहे जा॥ हालननो
छे छेकरम मतदी॥ जुवे रउवारमवारेजा
॥ पद २२ ॥ २००॥ पछे गोरे सुंउ ईं॥ गंगातणुं
वरणा मन॥ सेवक सारं गोरे के पुंकरं॥ सुणा
मुंमनथ छे के मन जा॥ पद २३ ॥ २०२॥ गो
रे कुंपोगलाबी मों॥ गंगवा कुवोने नुंनाम
जा॥ श्री गंगा जमांहे मुंकी आ॥ ओलाकुण
रनीहेठ जा॥ पद २३ ॥ २०३॥ धंन धंन गोरछ
मांमदीन॥ धंन धंनतमांरा मवतारजा॥

लगतुं सारुं काम केवां करां ॥ दुजनी वारे तुंहा
तार जो ॥ पद २ ॥ २५ ॥ ० ३ ॥ पां घरसोमके पीर
मोल मां ॥ गत्त के हुंत्ते नुं नां मनजो ॥ सहु सांन
नरनहुं साल लो ॥ गारे करांत्ते नां का मजो ॥ पद
२ ॥ २५ ॥ ० ४ ॥ हान रजोगहनुर मां ॥ नरप मह
ता गोरने पासनजो ॥ सत्त मुसल मांनत्ते
धर्मि ॥ दुलात्त धकुकाहा सेजो ॥ पद २ ॥ २५ ॥ ० पा
लेपणलत्ते कोली हत्ता ॥ गोरेत्ते नोहेत्ते आ
लो हात्तजो ॥ त्रीजो सेवक लेवोकणमी कधर्मि
॥ सा णां का कानेनुं नां मजो ॥ पद २ ॥ २५ ॥ ० ५ ॥
साथा सेवक लालमाराम क धर्मि ॥ त्ते पाण
कणमी केवा मजो ॥ पां ममां सेवक मीमा
मा धक धर्मि ॥ मालाराम नी मेन थामजो ॥
पद २ ॥ २५ ॥ ० ६ ॥ सेवा करी पां मेगारत्त णी

प्रेमेलगतीलरपुरख॥रनवइनाणीनवे
मनदीधां॥दोहलांदुणइरांदुरख॥परराप॥प
१०४॥सतगोरमुमथीमांअमरा॥सुणो
डालरमेगइलुरख॥अमेडधमितलेतमेणां
मसा॥नीसेलणगणेनदूरख॥परराप॥१०८
हुइथासेटहेलाहुरेमांहेरो॥पछीटहेयडस
तमांसेख॥वीसइटमछेटेतमतणी॥
थासेडुणरवमनहमांसेख॥परराप॥१०९॥
पेनीसलामतमनेलरे॥डुलमडडुणरत
मांरीख॥पेलाआपीस उतमनेनमो॥पछे
नमेडुणरहमांरीख॥परराप॥१११॥डुणरतमां
रीजे उपरे॥गमेतेवापडलापखसीतलरस
दारेडुणरतमत णीअपुंमांहुरांणुंमांपख॥

पद ॥ २५११२ ॥ सोपकुनेसनमांनदीधा ॥ व
मनपरमांणेथउंतेमनजा ॥ पेलीसनामडा
जरओगनो ॥ सीलजकुअरसनदांओजो ॥ पदरा
२५११३ ॥ हानरओगनेवेणआपीउं ॥ ना
आकुकुनेकीधांनांलजो ॥ अमअंडलगती
रेलली अमेनी ॥ अंनतरमां उपनुं छेवा
हालजो ॥ पदरा २५११४ ॥ नांआकुकुनेगोरे
अेम कउं ॥ ज्ञानमपरगणे कुकुसगामजो ॥ तघ
जवाध मनअमतगुं ॥ सुंन दरमनांवालघ
धामजो ॥ पदरा २५११५ ॥ मांनतामयालसे
तमलणी ॥ मांणसमलसे अपारजो ॥ अे
वांगारनांअमुंजकु मांनमलां ॥ नांआकु
कुनो धांनअवतारजो ॥ पदरा २५११६ ॥

सांणां कडुवे सेवक दुधिमे ॥ गोरे मापुं मवी
मनवमनन ॥ प्रेरे मम गतीमली मेमनी
॥ दुरी रपाकरी री जमनन ॥ ए रंग रा ॥१७॥ पु
सीथधिमुं रावंत मोली मा ॥ मे रलल गादीनी
उपरेन ॥ धंन धंन मवसार सांणां कडुवानो ॥ घा
णी मां रही धी छे डो रपा मन ॥ ए रंग रा ॥१८॥
कुणमी कुपां मे जतन ॥ गोरनी सेवा महुरव
रन ॥ दुमडां रालीमवी मलगादी सांपी ॥ सेवा
कुलपा मां सारन ॥ ए रंग रा ॥१९॥ प छमालव
रा मामगलत मला ॥ गोरेवेण मा पीउं मेमन ॥
त मेरे नाघो मलोतरवी मो ॥ दुकडुंत करोतेम
न ॥ ए रंग रा ॥२०॥ पेरलादने परगणांवी मो ॥
देवागाम कुधिमेने इन ॥ तांरेन धनिमुं काम करो ॥

भलांअनांवोने धांमल ॥प २० २प१२१॥ भा
भोअा धरीवकु कुधमे ॥ भालारा मनीअेन था
अल ॥ तेने गोरेवअन अेकहुं ॥ भाभाअा धरीसुं
णेतां अल ॥प २० २प१२२॥ सत्तगोर भुंअ
थीओ लीआ ॥ अमी रसुं णो भाभाआ धली
दूधा गा मथी अे कु गव उपरे ॥ गांमवरसा
वोतमेतां अल ॥प २० २प१२३॥ अमांरेने
न: १८
जीतधतिमतणी ॥ मांनता भालसे मनमांनीत
लत्रा उरवारस उतन आवसे ॥ गुरु गारसे शेंणी
वनन ॥प २० २प१२४॥ ला धमेन आनं हथध
आवी आ ॥ गोरे हीधुंतडा मल ॥ तांरे आवीने
मुडा मडुरा ॥ सुंदर अनावोतां धांमल ॥प २०
२प ॥ गउपर भाभाआ धमे ॥ सुंदर वसापुं

(९८)

अेकु गा मन॥ ते रे गा मनुं नाम त मन केहुं॥
सीखीला धनीरो गुरु केहेला मन॥ पर गाट॥१
२५॥ प्रेम सुं मन मां डी आपां मन॥ हे आ
पुरीसं कुरदा पां मन॥ सेवक पोतानां ना
णी करीस॥ वाले मारे मन पद आ पां
ना॥ परगट॥ १२७॥ हुल मनुं सेवा तणुं
मन मांनुं पोसउ वीआ रील जं दगी करे
तो आवा जे डीता रे अेवा गार उपकु
रीला॥ परगाट॥ १२८॥ अेबुं नाणी सउ मोमे
ना॥ नीत नीत गा रनुं लजो नां मन॥ गार
नर सभा हीमांन सा॥ ना ना सा वधकुरे
डा मन॥ परगट॥ १२९॥ अेनां कामनेकु

म छतां॥गोरे मारे नरसनां ढुकी घाल
॥पड हे थ आप छे रुं थ उं॥कुली झल मां की घां
कामल॥पद २ ॥ प १ ३०॥ अे कुरसमे गोरे
आवी आो॥आवी तगानीत मांहे ल॥लोडा
सहीत पंडे आवी आो॥वी कुनां आणीले गा
रज॥पद २ ॥ पा १ ३ १॥ कुकुसरवे कुवाल॥ग
आ॥लोडा उतारीने बारज॥अ मांरोगरे जोडा
रीनापीपे॥अे मक धनी ससमलव आोज॥पद २
॥ प १ ३ २॥ गोरे अे कुकुकु नही॥गआो रीनानी
मांहे ल॥गरु ल अे पर छोडे आडी आो॥छे आ
डी तणी वारज॥पद २ ॥ प १ ३ ३॥ गोरे तां थी
आली आो॥गआो पोताने मुकाम ल॥तांपुनां

आलो पादर वी आ॥ नां आ गार मताणे
गामण॥ पद २ गा २ १३४॥ रात पडे गोरी रेसु
धरिआ॥ सुतां नीद्रा लाईने पुरण॥ घडी भारे
छोली ओ उडाडी ओ॥ उडाडे सना माडाले दुरण
॥ पद २ गा २॥ १३५॥ मेडुत रहे छोली ओ ने धि
पडो [illegible] पडो मेडुं तल॥ मां नवी फ्री धिहे
नही॥ गार नुं ना राणुं मांणण॥ पद २ गा २ १३६॥
सुधमा वी सरे रेन॥ लुअ मारे पार सन॥ ओ ली
लुफ्री धिन ने ला ले नही॥ ला ने लोभी ने आ
फ्रासण॥ पद २ गा २॥ १३७॥ मरने फ्रीतां धिमें
मनी॥ पाछो आवी गार नी पास ण॥ आं धीगु
ने गार तमत्ताणे॥ मां ईशु नो फ्री सामण॥ पद २ गा २

१३८ ॥ त्रीलोकीनांथ जाणा नहीं ॥ नाल पालण
नो कीरतार ॥ मुं रे अमन मांस मले नहीं ॥ कुं
कुरुं नहीं नजर ॥ पर ९ ८ ॥ १३९ ॥ सत गोरने
छत्र अन धावी उं ॥ वीनती करे वार मवार ॥
दास लागीने दआ करो ॥ त्रीलोकी तार पाहा
र ॥ पर ९ ८ ॥ १४० ॥ वीध वीध परे वीनती
करो ॥ दुर करुं गोरे दुअन ॥ कीर पा धरे उपेर
मुं करो ॥ तारे सरीर थउं सुअन ॥ पर ९ ८
१४१ ॥ अेवी रीते तेने सुं अथउं ॥ अेवा परेम
सुअ कारीन ॥ अर मां लेवा आयो गोर ताणां
॥ पर छे देआडी करुं सुअन ॥ पर ९ ८ १४२ ॥
अेवा पर छातो आपार छे ॥ कुरला करुं वीसता

रीजा॥ सेरली बुधी पीमेनहीं॥ थोडामां
कहुं कुंवी सत्तारीजा॥ परगट १४३॥
मेकुरन मे मेलगावी मे॥ गोके कहुं मेकु
कामजा॥ परगट पर छो मे पो पुरी मो॥
सउ सुणो मु मन लाधजो॥ परगट १४४॥
धलागरो धणीनो कुछ मे॥ मावनगर
नो वीसत्तारीजा॥ तउपर मकुरमडाव
पा॥ मनुं समजुं छे मपारजा॥ परगट १४५॥
मेनल कुरे सउमली॥ मकुर मडवा तणी
वारजा॥ धणी परकारे परा कुरमकुरां॥
मकुर मडुं न छलीगारजा॥ परगट १४६॥
मकुर नारे मडुं नहीं॥ सरपे वी मारे मन

માંહીજ ॥ એ કેઉપા એ માલોન હી ॥ નકલી
લોકતે ડાભ હુંજ ॥ ૫ રગ ૨૫ ૧૪૭ ॥ મેનતક
રીતાંહાં બહુ અપાર ॥ અકુરમ હું નહીંતેણી
વારજ ॥ ૫ રતા બાલુ રસ ઉધા ભાઈ ॥ કામ બાન દેવાં
તાં એમ ॥ ૫ રગ ૨ ૧૪૬ ॥ અરન ક રેતાં ધમાં
મન ॥ તું ધું ન ગાનો એ ધારજ ॥ અકુરમ [illegible]
ડનહી ॥ કારણ અનું રસું કીરતારજ ॥ ૫ [illegible]
૧૪૮ ॥ દુની આ માં કા ધાલો ન હીં તુન વી
નાં ઝીલો વન રાજ ॥ તારાતાં મનું અકુર
અ ડન ધી ॥ કારણ આ રસું દેવા અજ ॥ ૫ રગ ૨
૧૫૦ ॥ અરન સું ણી સેવક તણી ॥ વારેમ

ડાતેણીવારનાાકુ કીરીયેસેપંડઆવીઆાા
આવાનગામાંતેણીવારનાાપરગટાા૨૫ાા૨૫
એગાથઆાસઉમલીાાઆપેબોલાત્રીલો
કીનાંથનાાકેમરેકારણસોખાતુરથઆાા
એયુંપુંછેતેણીવારનાાપરગટાા૨૬પરાાએ
વીરસતેનરેપુંછીઉંાાસઉંકાંબોલાતેણીવા
[illegible]કરમડાવામેનતકરીાાએકેઆલોન
ડીંઉપાઅનાાપરગટ૨ાા૨૭ાાએવુંસુંણી
આપેઓઅરપાાનરવેસુંણીનેતમાંમનાા
મેનતકરીએઆલોસઉમલીાાનાંમલેધ
નેધમાંમનાાપરગટાા૨૮ાાવચનસુણી
સઉંઉડીઆાાઅકરમડાવેતેણીવારનાા
આપેહાતનાંઅડાડીએાાઅકરઅકુંતેણીવાર
નાા

પરગટા૮પપ॥ એકદમ અકરનાં હું એકું॥
આનંદ થઆ સઉને તાંઈ જા॥ તેરે સ મે તેરે
ગોરત ણો॥ મર મનાં જાણે લગાર જા॥ પરગટ
૮પ૬॥ પછી આગેરા માલીઆ॥ અલોપ થ
આગોર ઈમાં મ જા॥ સાધા પણ જડા નહીં॥
બઘેતપાસું તમાં મ જા॥ પરગટા૮૫૭॥ એ
પીરીતે ગોરે કામકરાં॥ કુડા કુલે જુગની માંહે
જા॥ આપે પરગટ જંબુદીપ માં॥ પરગટ પર
છાદે ઓતાંહે જા॥ પરગટા૮પ૮॥ એ પછી
એ અવતાર વીસા॥ ગોરે કુંએ કુલ મજા॥ કલ
જુગાકુંડા ઘણો વાપી ઓ॥ તે માં ગોરે કરાંકા
મજા॥ પરગટ૮૫૯॥ વાલ પર મુજે જીવીસાં
અલીપ॥ તેવી કીધી છવીસતારી જા॥ માંટે કરી
સઉને અરજ કરુંપ॥ દાસનાં ગણ સોલગાર જા॥
પરગટ ૮૬૦॥

સંવત વીક્રમની ને ૮ઈ એ ॥ ગણસે મેત
રી સનીસાલ જે ॥ માંસલા દરવાભરપુર
માં ॥ કામ અનુએ કવી સતારજ ॥ અપરગાર ॥
૧૬૧॥ નથું કાકાના રે ઠકુર થીઆ ॥ પદીગાદી
એ પેસેતે કાણ જ ॥ સર વે મલીતાં વીઆરી
ઉં ॥ ગાદી એએ ડાનો કર ઉપાએજ ॥ અપરગાં
ર ૧૬૨ ॥ જ માંત સરવે તે ડાવી એપ ॥ આવી
મલ સરવે તાં હેજ ॥ સરવે મલી ગાદી એ
પે ઠાતણી ॥ વાત કરે વારમ વારજ ॥ અપરગાર
૧૬૩॥ કરાવ કરતાં થ મલી રએ ॥ દીવસ
ત્રણ થઆ તાં હેજ ॥ માંહો માંહે મત બોલી
આ ॥ મતી એક લાઈ ન માંતજ ॥ અપરગાર
૧૬૪॥

મનનાં સાચો મોરા તણ ગ॥ ગોરે જાણું એ
હું કેવા અજ॥ ઘરડ ભઈ રસાં દેવા દાસના॥ ઘ
ણી માંરા કેવાં કરે કામ જ॥ પરગ॥ ૨॥ ૮૬॥
સુંજાણ સ ઉકાર સ ડી આ॥ ગાર મથા ગામ
નારે વાસી જ॥ ગોર સપનાં માં તેને આવી
આ॥ વાત કીધી છે વી સસારો જ॥ પરગ॥ ૨॥
૮૭॥ તું જાણ ઈનિ ગાવી એ॥ વી વેકે કરો જ
ઈનિ વાત જ॥ કુહુંત પર માં ણેત મેજ ઈકીદું॥
ત ઈ સઉ મલી છે જ માંત જ॥ પરગ॥ ૨॥ ૮૮॥
વાદવી વાદ કરવા ને હીં॥ કા કાપર માંણે કરા
કામ જ॥ રો જા સત ગોરનાં સા માં રહી॥ એડી
પેરો ને સઉ આજ॥ પરગ॥ ૨॥ ૮૯॥ સ
ન મુખ થઈ નિ સાચા જા॥ એડી ટું રેજ નીતાં
અજ॥ એડી ટું ટે તે ગા દી અ એ સો॥ ને તાગા
દીનો અધી કાર જ॥ પરગ॥ ૨॥ ૯૦॥ એવી

રતેન ઈકીદુ॥ગારે કહું સપનાં માંહે જી॥પરલા
તેઆવો પોતે પ્રેમથી॥આવો રેલાનીપા
સજી॥૧૭૦॥નાણ કહું સઉલમાંતનો॥વીરસ
તારીને કીધી વાત જી॥વાત સુંણી સઉકાર
તાણી॥જુસી થઈ દિન માંત જી॥પરગટ॥૧૭૧॥
વાતગમી સહું સાદાતનો॥ગામી કાકાસ
હુને તાંહે જી॥એવું સુણી નેઆનંદ થઆ
॥એડી પેરાનો કરે છે ઠરાવ જી॥પરગટ॥
૧૭૨॥નમાંત સરવેલે ગાથઆ॥કાકાઆ
વાસહુ તાંઅલજી॥એડી પેરીને સન મુંખ
આલો॥ધાણી માંરે તાં કવાં કરે કામ જી॥
પરગટ॥૧૭૩॥એડી પેરીને એક આલી
આ॥રોલા સામાંતે ણી વાર જી॥પરગટ એ

ડીપણ ટુંટીનહીં અેક અેક પેરી [redacted]

કરીની અેડીપણ ટુંટીનહીં અેક અેક

કઆ અેક ... ખીનાને પેરાવેને

ગીવારજા પરગટા ૭ ત્તેની પણ

ટુંટીનહીં અેક અેક પેરીત્ત માંમ કા કીની

અેડીપણ ટુંટીનહીં કાકાકરમ સીર આમે

ક પરગટા ૭ પા અેડીનારે ટુંટીનહીં

સરવે થઆમન ઉદા સત સરવે મલી

ને વીસારે કરી ગોરને કરે છે અરદાસ સત

પરગટ ૭ કા પાપ ધંન ધંન ગોર ઈમાં

મ સરન સું ગીનાન અમાંરી આ અવસર

માં આ અછે ત્તમાંરી કલીકાલ

માં કામ કા દુનીઆવું નવ કીના આ કરીદ

લમાં ધાર ડલ કું સાંદીના દીહેરા

સાચે કરી હેરિ સમરત ઘણી ॥ આજ કછણ કુ
ળી કાલમાં ॥ કહે અનધું દીએ આધાર ખું ॥ પરગ
ટ આપે છો હુ કાલમાં ॥ રાગ પરભાતી એ
વીરીતે અરજ કરી ॥ ગોરે છોતે જાણ રાખણ
હાર ॥ તેને પઢ કે સરરવેની સાચ મ કરીને ॥ વેગે આ
પો આપણી વારે ॥ પરગ ૨૫ ૨૧ ॥ જમાંત
સર વે કુર માં વરઉં ॥ કાકા કરમ રતીને તાંહે
જા ॥ એડી પેરે તમે પૂરે મથી ॥ રાજ થઈ
હેલ માંતજ ॥ પરગ ૨૬ ॥ કુર મ રતી કા
કતાં એ તો તી આજ માંત રંગુણી તે માં મળ
॥ એવું માં રેતા ધનિવતો ધનીએ ગોરે નરસે
વાતો આ ધીકાર જ ॥ પરગ ૨૭ ॥ કુરી

જમાંતેજેં ઈરમાંવી ઉંઅેડોપેરીતણીવાર
જા॥ અરજઈરેગોરઈમાંમનૅ॥ દાસનીવેગઈરજો
વાસજ॥ પરગ॥ ૨૯૦॥ અસતુતીસુણીંસેવ
કતણી॥ ધણીમાંરેકરીછેકીરપાઅજ॥ નાંમઈ
માંમનુંલેઈ [illegible]લીઅ॥ અડાકુબેડીઆગીતાં
અજ॥ પરગ॥ ૨૯૧॥ જેજેકારતાંહુંથઈરઓ
॥ આનંદથઓરઉનેતાંહુજા॥ નગારાનોઅત
ડંકાવાગીઆ॥ આરતીગોરનીઉતરાઅજ॥
પરગ॥ ૨૯૨॥ સરવેમલીગાદીપાસે॥ કરમ
સીકાકાનેબેસારેજા॥ નાંમઈમાંમનુંલેઈકરી
॥ પેરેમેપાગડીબાંધાવેજ॥ પરગ॥ ૨૯૩॥
ધંનધંનગોરઈમાંમનૅ॥ ધંનધંનતમારા
નેદાસજા॥ દેવધણાછે દુનીઆવીબે॥ પર
ગરપરછાનઈકોંઈજા॥ પરગ॥ ૨૯૪॥

(૨૫)

પરગટ પરછ એવા પુરીઆ ।। ગણતાંજ
ણીનાં સકુઆમજ ।। અકલ કલા છે એ ગોરત
ણી ।। મરમનાં ણે નહી કોઈ જ ।। પરગટ ૨૭
એ પછી આરસ પાંણનાં ।। પર છે પુરી આણે
વાસજ ।। આરસ પાણને ઈસરો જ કુનો ।। સ
ઉકો કે આંથી લવા મજ ।। પરગટ ૨૮ ફુ ।। સ
પનાં માંગી રઆવી આ ।। આવી બોલા એ
વીવાણજ ।। રોજ થકી નઈ રૂતે કુંણ મં ।। આ
રસપાણની છે પાંણજ ।। પરગટ ૨૯ ।। સ
તે પર માં ણેતાં પોહી ઉં ।। ની સરો આરસ આ
ણ માં મજ ।। તે રેલાવીને રોજ આગલો ।।
મોર સીધાં ધાવી છે સારજ ।। પરગટ ૩૦ ।।
એવા પરછ ઘણા પુરી આ ।। ગણતાં ગપ્ર

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

realpatidar.com

(૨૭)

રાહુરજો ॥ પરગટા ૧૯૩ ॥ અરજમાંગીએ
એટલી ॥ સહેજ માંતને લાગું પાએજો ॥
ભુલચુક માં રીમાંફ કરો ॥ દાસ આરાજે
દાસ મોહે જો ॥ પરગટા ૧૯૪ ॥ પાંગલ પા
રજાણું નહીં ॥ માંત્રા અખરગાણું નહીં જો
॥ મોટા સાત્રપાઠની ખાન નહીં ॥ સતગુ
રજી જો ॥ પરગટા ૧૯૫ ॥ દાસ આગલ
જે મતાંતણું ॥ મેરૂં આગલ ત્રાણું જો ॥
પૃથ્વી પરમાંણે હું મેં બોલી આ ॥ જેવી
તેવી વાણી તે મેં જો ॥ પરગટા ૧૯૬ ॥
આગણીસે આડત રીસની સાલમાં
॥ સાવણ સુદ બીજને સોમવાર જો ॥

તેરેદીવસસંપુરણથયો॥ગારનીબોલો
જેજેકારજ॥પરગટપરઘોગારધર્માં
મના॥૧૮॥૭॥પરઘોસંપુરણથયા
છે લખીતંગ બાઈકેસારબીબીજ
નવલદેએમેદાસનીઅસલીમીઆ
વાંચેતેનેસલામછેભુલચુકમાફકર
જો

realpatidar.com

ગામનેતરા માંહ્યાં સદા હેતકારી
પ્રેમ સને હી પરે લકુરમ સી સવ
જનીસરણમજીવીઘણીહોજો અ
તાન સી ગામ કોડ ડાયીલખી તં
ગ મુખી જેઠાનાં ઈઆં તથા નાંનકડી
મુખી આણીબાઈ દેવકી નાં દવા
સલામ વાંચજો અને ગરૂનાં પર
તાપથી અમે સાજા નરવા થયા
છુઈએ તેતમારે દવા કરી એર
માં હેત રાખો છો તેથીવ ઘુંરા
જજો એન વીતી ગુણવંતને ઘ
ણું શું લખીએ થોડું લખ્યું ઘણું ક
રીવાંચજો શંવત ૧૯૪૯નાં
માંહાં સુદ ૨ને વાર ગરે ઉને
રાતનાં એ વાગતાં લખ્યો છે
લખાર તાંગલી [illegible]
મહમદ અલી

realpatidar.com

